

EDUMATERIALS

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1

પ્રકરણ - 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત

1. ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે ?

- (A) સમય (C) ફિલ્મો
(B) ઇતિહાસ (D) દેશ-વિદેશ

2. કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે ?

- (A) કાર્બન ડેટિંગ પદ્ધતિથી (C) ત્રણેય પદ્ધતિથી
(B) બેઈઝ ટેસ્ટ પદ્ધતિથી (D) એસિડ ટેસ્ટ પદ્ધતિથી

3. શામાંથી આપણને ઇતિહાસ વિષયક જાણકારી મળી રહે છે ?

- (A) સંગ્રહપોથીમાંથી (C) એકેયમાંથી નહીં
(B) હાલના વાસણોમાંથી (D) આજના નકશામાંથી

4. પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખશો ?

- (A) ભાષાવિદ (C) ઇતિહાસવિદ
(B) સમાજવિદ (D) પુરાતત્ત્વવિદ

5. જ્યાં અભિલેખો રાખવામાં આવે છે તેને શું કહે છે ?

- (A) અભિલેખાલવન (C) અભ્યાસલેખાગાર
(B) અભિલેખામકાન (D) અભિલેખાગાર

6. શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે ?

- (A) અમદાવાદમાં (C) પાટણમાં
(B) વડોદરામાં (D) રાજકોટમાં

7. તાડના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતા લેખોને શું કહેવામાં આવતું ?

- (A) તાડપત્ર (C) તામ્રપત્ર
(B) ભોજપત્ર (D) ભૂપત્ર

8. તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે ?

- (A) સધુક્કડી (C) અવધિ
(B) ભોજપુરી (D) પાંડુ

9.રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે ?

- (A) મુંબઈ (C) કોલકત્તા
(B) દિલ્લી (D) ચેન્નઈ

10.તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે ?

- (A) ભોજપત્ર (C) તાડપત્ર
(B) ભૂપત્ર (D) તામ્રપત્ર

11.પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહે છે ?

- (A) તાડપત્ર (C) તામ્રપત્ર
(B) શિલાલેખ (D) ભોજપત્ર

12.જ્યારે વીસમી સદી પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી,તેને શું નામ આપવામાં આવ્યું હતું ?

- (A) મિનિમમ ગેલેરી (C) મિલિયન ગેલેરી
(B) મેક્સિમમ ગેલેરી (D) મિલેનિયમ ગેલેરી

13.ઘાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે ?

- (A) અભિલેખો (C) ભોજલેખો
(B) પાષાણલેખો (D) ઘાતુલેખો

14.ભૂર્જ નામનાં વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે ?

- (A) જૂનાગઢ (C) હિમાલય
(B) અંબાજી (D) પાવાગઢ

15.વર્તમાનને સમજવા માટે શાની જાણકારી હોવી જરૂરી છે ?

- (A) ભવિષ્યકાળની (C) ત્રણેયની
(B) ભૂતકાળની (D) વર્તમાનકાળની

16.અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી ?

- (A) તાડપત્રો (C) ત્રણેયનો
(B) તામ્રપત્રો (D) શિલાલેખો

17.ભૂર્જ નામનાં વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રોને શું કહે છે ?

- (A) ભોજપત્ર (C) તામ્રપત્ર
(B) તાડપત્ર (D) ભૂપત્ર

પ્રકરણ - 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત

- | | |
|--------|--------|
| (1) B | (10) D |
| (2) A | (11) B |
| (3) A | (12) D |
| (4) D | (13) A |
| (5) D | (14) C |
| (6) C | (15) B |
| (7) A | (16) A |
| (8) D | (17) A |
| (9) B | |